



ISO 9001 : 2015
Reg. No. RQ91/5487



JSL INDUSTRIES LTD.

Registered Office & Works

Village Mogar-388 340, Tal. & Dist. Anand, (Gujarat) (India)

Phones : 02692 - 280224, 280254, Fax : 02692 - 280227

E-Mail : jsl@jslmogar.com • Website : www.jslmogar.com

CIN NO. L31100GJ1966PLC001397

By Electronic Mode

August 31, 2020

To,

BSE Limited

P. J. Towers,

Dalal Street,

Mumbai – 400 001

Security Code - 504080

Subject: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith a copy of the Notice of 54th Annual General Meeting ("AGM") of the Company to be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ('OAVM'), Book Closure and E-voting information published in English and Vernacular Language (Gujarati) newspaper on August 31, 2020 in Indian Express (English edition) and Financial Express (Gujarati edition) respectively.

We request you to please take the same on record.

Thanking you,


Yours faithfully,

For **JSL Industries Limited**


Ishwar Nayi
Company Secretary



Encl: As above



JSL INDUSTRIES LIMITED

Registered Office: Village - Mogar, Dist. Anand - 388 340, (Gujarat)

Tel. No. 02692 - 280224, 280254, Fax: 02692 - 280227. CIN-L31100GJ1966PLC001397

Email: cs@jسلمogar.com Website: www.jسلمogar.com

NOTICE OF THE 54th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 54th Annual General Meeting (54th AGM) of the Members of JSL Industries Limited will be held on Saturday, 26th September, 2020 at 11.00 a.m. through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) to transact the business, as set out in the Notice of the 54th AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Friday, 28th August, 2020, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agents, M/s. MCS Share Transfer Agent Ltd./Depository Participant (s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 8th April, 2020 and 13th April, 2020 and The Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.jسلمogar.com, BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 19th September, 2020 to Saturday, 26th September, 2020 (both days inclusive) for the purpose of 54th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the The Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 54th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on 19th September, 2020 ('cut-off date').

The remote e-voting period commences on Wednesday, 23rd September, 2020 at 9.00 a.m. and will end on Friday, 25th September, 2020 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend /participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date ; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).

For, JSL Industries Limited

Ishwar Nayi

Company Secretary

Place: Mogar

Date : 29th August, 2020



જેએસએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ : ગામ - મોગર, જિલ્લો-આણંદ-૩૮૮૩૪૦ (ગુજરાત)

ટે.નં., ૦૨૬૯૨-૨૮૦૨૨૪, ૨૮૦૨૫૪, ફેક્સ:૦૨૬૯૨-૨૮૦૨૨૭, CIN-L31100GJ1966PLC001397

ઈ-મેલ : cs@jسلمogar.com વેબસાઈટ : www.jسلمogar.com

પરમી વાર્ષિક સામાન્ય સભા યોજવાની સૂચના અને બુક કલોઝર તેમજ રીમોટ ઈ-વોટીંગની વ્યવસ્થાની માહિતી

આથી સૂચના આપવામાં આવે છે કે જેએસએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સદસ્યોની પરમી વાર્ષિક સામાન્ય સભા (પરમી એજુએમ) શનિવાર, ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી)/અન્ય ઓડીયો વિઝ્યુઅલ (ઓએવિએમ) સાધનોથી યોજાશે. તેમાં પરમી એજુએમ યોજવા માટેના સૂચનાપત્રમાં જણાવેલી બાબતો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એજુએમ યોજવાની સૂચના શુક્રવાર, ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ, એવા તમામ સદસ્યોને જેમણે કંપનીના રજીસ્ટર અને શેર ટ્રાન્સફર એજન્ટ: મે/સ. એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડ/ડિપોઝિટરી પાર્ટીસીપન્ટ્સ પાસે તેમના ઇમેલ સરનામાની નોંધ કરાવી છે તેમને, ઇલેક્ટ્રોનિક માધ્યમથી, અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તા.૫મી મે, ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલા પરિપત્ર તા.૮મી એપ્રિલ, ૨૦૨૦ અને તા.૧૩મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલા પરિપત્ર અને સિક્યુરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના તા.૧૨મી મે, ૨૦૨૦ના પરિપત્રના સંયુક્ત અમલ રૂપે પાઠવવામાં આવી છે. કંપનીનો વાર્ષિક અહેવાલ અને એજુએમ યોજવા માટેની સૂચના કંપનીની વેબસાઈટ www.jسلمogar.com બીએસઈ લિમિટેડની વેબસાઈટ www.bseindia.com અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઈટ www.evotingindia.com પર ઉપલબ્ધ છે.

આ નોટિસની સાથે જ જણાવવામાં આવે છે કંપનીની પરમી વાર્ષિક સામાન્ય સભા યોજવાના અનુસંધાને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ને અનુસરીને કંપનીનું રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક શનિવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ થી શનિવાર, ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે.

કાયદાની કલમ ૧૦૮ અને ૩૯-૨૦ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એક્ઝામીનીટીશન), ૩૯સ, ૨૦૧૪ સુધારેલો અને સેવી (લિસ્ટીંગ ઓબલીગેશનસ એન્ડ ડીસકલોઝર રીકવર્મેન્ટસ) રેગ્યુલેશનસ, ૨૦૧૫ની કલમ ૪૪ની જોગવાઈઓને આધીન પરમી વાર્ષિક સામાન્ય સભા માટેની સૂચનામાં જણાવ્યા પ્રમાણેના તમામ કરાવો અંગે પોતાનો મત વ્યક્ત કરવા સીડીએસએલની ઈ-વોટીંગ સેવાઓ દ્વારા સદસ્યોને ઈ-મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. તા.૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ (કટ ઓફ ડેટ)ના રોજ કંપનીની પેઈડ અપ શેર કેપીટલમાં સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલા ઈકવીટી શેર્સના પ્રમાણસર તેમને મતાધિકાર મળશે.

બુધવાર, તા.૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સવારના ૯:૦૦ વાગે રીમોટ ઈ-વોટીંગ શરૂ થશે અને તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ને શુક્રવારના રોજ સાંજના ૫:૦૦ વાગે તે પૂરું થશે. સદસ્યો આ સમયગાળામાં ઈ-વોટીંગ કરી શકશે. તે પછી, સીડીએસએલ દ્વારા રીમોટ ઈ-વોટીંગ મોડ્યુલ નિષ્ક્રીય કરવામાં આવશે. એવા સદસ્યો, જેઓ એજુએમમાં વીસી/ઓએવીએમની સુવિધા દ્વારા હાજરી આપી રહ્યાં હશે અને જેમણે રીમોટ ઈ-વોટીંગ સુવિધા હેઠળ કરાવો પર મતદાન નહીં કર્યું હોય, અને તેઓ અન્ય કોઈ રીતે મતદાન માટે અમાન્ય નહીં હોય, તેઓ એજુએમ દરમિયાન ઈ-વોટીંગ સિસ્ટમથી મતદાન કરી શકશે.

જે સદસ્યોએ એજુએમ પૂર્વે રીમોટ ઈ-વોટીંગ દ્વારા મતદાન કરી લીધું હશે, તેઓ વીસી/ઓએવીએમના માધ્યમથી એજુએમની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે પરંતુ તેઓ ફરીથી મતદાન નહીં કરી શકે.

એજુએમ યોજવાની નોટિસમાં એવા સદસ્યો કે જેઓ કિમેટ પ્રકારે, ભૌતિક રીતે શેરો ધરાવે છે અને જે સદસ્યોએ તેમના ઈ-મેલ સરનામાની નોંધણી કરાવી નથી, તેઓ કેવી રીતે મતદાન કરી શકે તેની પદ્ધતિ જણાવવામાં આવી છે.

કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક્સની નોટીસ પાઠવી દેવામાં આવે તે પછી એવી કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને કંપનીનો સદસ્ય બને છે અને નિર્ધારિત કટ ઓફ ડેટની તારીખે કંપનીનો શેરધારક છે; તે helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકશે. પરંતુ જો, આવી વ્યક્તિ સીડીએસએલમાં રીમોટ ઈ-વોટીંગ માટે નોંધણી ધરાવતો જ હશે તો તે મતદાન કરવા માટે તેના પ્રવર્તમાન યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને મતદાન કરી શકશે.

ઈ-વોટીંગ માટેના કોઈપણ પ્રશ્નો હોય તો સદસ્યો www.evotingindia.com પર હેલ્પ સેક્શનમાં ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો(એફએક્વેસ્ટીયન્સ) અને ઈ-વોટીંગ મેન્યુઅલની મદદ લઈ શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com ને પ્રશ્નોનો ઇમેલ મોકલી શકે છે અથવા શ્રી નીતિન કુટેર (૦૨૨-૨૩૦૫૮૭૩૮) અથવા શ્રી મહેબૂબ લાખાણી (૦૨૨-૨૩૦૫૮૫૪૩) અથવા શ્રી રાકેશ દળવી (૦૨૨-૨૩૦૫૮૫૪૨) નો સંપર્ક કરી શકે છે.

સ્થળ: મોગર
તારીખ: ૨૯મી ઓગસ્ટ, ૨૦૨૦

જેએસએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી
ઈશર નાથી
કંપની સેક્રેટરી